



જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૧/૦૨/૨૦૧૯ શુક્રવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૦૫/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૫૧ કેસ કરી, ૪૪ વ્યક્તિઓને ઝડપી, ૪૨૧ લીટર દેશી દારૂ, ૩૮ બોટલ ઈંગ્લીશ દારૂ, ૧ ક્વાર્ટર ઈંગ્લીશ દારૂ, ૨૪ બિયર ટીન, અને ૧ ઓટોરીક્ષા કબજે કરી હતી. તેમજ જુગારધારા હેઠળ ૭ કેસ કરી, ૨૦ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૫૨,૫૦૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૦૬/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૨૫ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી.૯૩ મુજબ ૪ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૬ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડી :-

સમાચાર યાદી નં.૨૦૭/૧૯

ઘાટલોડીયા: રાણાભાઈ હરજીભાઈ ભરવાડ (ઉ.વ.૫૦)(રહે.પ્લોટ નં.૧૨૮ જાદવનગર ભરવાડવાસ મેમનગર) એ તા.૩૧/૦૧/૧૯ નારોજ ઘાટલોડીયા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૩/૧૨/૧૮ કલાક ૮/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘર નજીકથી આરોપી ભાવેશભાઈ ભીખાભાઈ પટેલ (રહે, પટેલ વાસ ગામ-ધુમા) રાણાભાઈની મહિન્દ્રા ટીયુવી કાર નંબર જીજે.૦૧.એચડબલ્યુ.૪૨૪૧ કિંમત રૂપિયા ૮,૦૦,૦૦૦/- બે ત્રણ દિવસમા પાછી મુકી જવાનું કહી લઈ જઈ આજદિન સુધી પરત નહી આપી રાણાભાઈ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એન.વી.ચાવડા ચલાવે છે.

ચોરી:-

સમાચાર યાદી નં.૨૦૮/૧૯

શહેરકોટડા: લતાબહેન ડો/ઓ વિજયકુમાર સોમેશ્વરા (રહે,રાધે કોમ્પ્લેક્ષ, તપોવન સોસાયટીની બાજુમાં અનિલ સ્ટાર્ચ રોડ સરસપુર) એ શહેરકોટડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૩૦/૦૧/૧૯ રાતના ૯/૩૦ વાગ્યાના સુમારે એ.એમ.ટી.એસ. બસ નંબર.૧૫૧ માં શીવરંજની બસ સ્ટેન્ડથી આસ્ટોડીયા દરવાજા તથા એ.એમ.ટી.એસ. બસ. નં.૩૩ આસ્ટોડીયા દરવાજાથી સરસપુર રવિશંકર ઔડાના મકાન પાસે આવેલ શ્રીનગર બસ સ્ટેન્ડ વચ્ચે અજાણી વ્યક્તિએ લતાબહેનની નજર ચુકવી પર્સમાંથી સોનાનું ડોકીયુ કિંમત રૂપિયા ૪૦,૦૦૦/-, પાનકાર્ડ અને રોકડ રૂપિયા ૪,૫૦૦/- મળી કુલ રૂપિયા ૪૪,૫૦૦/- મતાની ચોરી કરી લીધી હતી. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.ડી.કલરા ચલાવે છે.

વાહન ચોરી:-

સમાચાર યાદી નં.૨૦૯/૧૯

વાસણા: મેલારામ ભાઈલાલભાઈ સોલંકી (રહે.પ્રવિણનગર વણઝારા વાસ સામે ઓડની ચાલી વાસણા) એ તા.૨૫/૧૨/૧૮ રાતના ૯/૩૦ વાગે વાસણા સોરાઈનગરના ખુલ્લા મેદાનમાં પોતાની ટાટા કંપનીની આઈવા ડમ્પર ગાડી નંબર જીજી.૦૧.સીવાય.૨૩૭૦ કિંમત રૂપિયા ૯,૦૦,૦૦૦/- પાર્ક કરી હતી. જેની ચોરી તા.૨૮/૧૨/૧૮ રાતના ૯/૦૦ વાગ્યા દરમ્યાન થઈ હતી. આ અંગેની ફરીયાદ મેલાભાઈ સોલંકીએ તા.૩૧/૦૧/૧૯ નારોજ વાસણા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી જી.જી.ચાવડા ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.